https://archive.org/details/bk799/page/n0/mode/1up

All Items on https://archive.org/details/realpatidar
realpatidar.com
Full Library on https://realpatidar.com/library



દૈત્યગુરૂ ઓધવરાય નમઃ

હિંમતાસુર
કુળદેવી દિતિય નમઃ

લક્ષ્મી નારાયણ ની ઉત્પતી

:- સમજણ પ્રત્રિકા -:

:આદ્ અસુર નારાણરામજી)

અસત સનાતનીત્તી ઉત્પતીનો ઈતિહાસ

સનાતન નો અર્થ:-

જિસકા આદ નહિ હૈ, જિસકા અંત નહિ હૈ, વોહી સનાતન હૈ, તો માત્ર સ્વયંમ નારાયણ જ છે. અને એ નારાયણ યુગવારા પ્રમાણે અવતાર ધારણ કરે છે. અને તે અવતાર પાત્રને યુગવારા પ્રમાણે ઓળખીને પુજે તે જ સાચા સનાતની કહેવાય છે. અને તે છે સતની એ રાહે ચાલનાર સતપંથી જ સાચા સનાતની છે. માટે સનાતન તો માત્ર સતપંથ જ છે.

બીજી બાજુ સૃષ્ટીની ઉત્પતી કાળથી જ સતની સાથે અસતની પણ ઉત્પતી થયેલ છે. તે પણ એક સનાતન જ છે. પણ એ છે અસત સનાતન અને એ અસત સનાતન નુ કાર્ય સતનો વિરોધ્ધ કરવો અધર્મ આર્ચવો અને અસતના માર્ગે ચાલનારને અધર્મી, વિધર્મી, ઠોલીયા, કહેવાય છે. અને તે પણ એક સનાતન જ છે. પણ એ અસત સનાતન છે.

આમ સત ઉપર ચાલનાર ભગવાન નારાયણના રૂપને ઓળખનાર માનનાર સતપંથી છે. જયારે અધર્મ ના પંથે ચાલનાર અસુરો અધર્મીઓ , દહિત્યો, ઠોલિયાઓ, લક્ષ્મીનારાયણ છે. આમ એ બંને પોતાના સિધ્ધાંત ઉપર બરોબર છે.

અધર્મી ઓનો ઈતિહાસ અને ઉત્પતી

સૃષ્ટીની ઉત્પતી કાળમાં કસ્યપ ઋષિની બે પત્ની ઓ હતી. એકનુ નામ દિતી અને બીજી નુ નામ અદિતી હતુ. અદિતી સાત્વીક ભાવનાવાળી હતી.

—) સનાતનિયોના ૬ અસુરો ધનસુરા મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં ન આવ્યા તો તમારી ખેર નથી. નહિતર પરિણામ ભૂંડા ભોગવવા જેવું થશે. જેની જાણકારી થી નોંધ લેવી

1 રમેશ વાઘડિયા
૨ હિંમતીયા ભીતાણી
3 પ્રેમલા કેસરાણી
૫ રમેશીયા નારાણી
5 જયંતી ઇધરાણી
6 નારણીયા રામજી

realpatidar.com

https://archive.org/details/bk799/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

realpatidar.com

દૈત્યગુરૂ ઓધવરાય નમઃ

હિમતાસુર →
કુળદેવી દિતિય નમઃ

લક્ષ્મી નારાયણ ની ઉત્પતી

:- સમજણ પ્રત્રિકા -:

:આદ્ય અસુર નારાણ(રામજી)

અસત સનાતનીની ઉત્પતીનો ઈતિહાસ

સનાતન નો અર્થ:-

જિસકા આદ નહિ હૈ, જિસકા અંત નહિ હૈ, વોહી સનાતન હૈ, તો માત્ર સ્વયંમ નારાયણ જ છે. અને એ નારાયણ યુગવારા પ્રમાણે અવતાર ધારણ કરે છે. અને તે અવતાર પાત્રને યુગવારા પ્રમાણે ઓળખીને પુજે તે જ સાચા સનાતની કહેવાય છે. અને તે છે સતની એ રાહે ચાલનાર સતપંથી જ સાચા સનાતની છે. માટે સનાતન તો માત્ર સતપંથ જ છે.

બીજી બાજુ સુષ્ટીની ઉત્પતી કાળથી જ સતની સાથે અસતની પણ ઉત્પતી થયેલ છે. તે પણ એક સનાતન જ છે. પણ એ છે અસત સનાતન અને એ અસત સનાતન નુ કાર્ય સતનો વિરોધ્ધ કરવો અધર્મ આચર્વો અને અસતના માર્ગે ચાલનારને અધર્મી, વિધર્મી, ઠોલીયા, કહેવાય છે. અને તે પણ એક સનાતન જ છે. પણ એ અસત સનાતન છે.

આમ સત ઉપર ચાલનાર ભગવાન નારાયણના રૂપને ઓળખનાર માનનાર સતપંથી છે. જ્યારે અધર્મ ના પંથે ચાલનાર અસુરો અધર્મીઓ , દહિત્યો, ઠોલિયાઓ, લક્ષ્મીનારાયણ છે. આમ એ બંને પોતાના સિધ્ધાંત ઉપર બરોબર છે.

અધર્મી ઓનો ઈતિહાસ અને ઉત્પતી

સૃષ્ટીની ઉત્પતી કાળમાં કસ્યપ ૠષિની બે પત્ની ઓ હતી. એકનુ નામ દિતી અને બીજી નુ નામ અદિતી હતુ. અદિતી સાત્વીક ભાવનાવાળી હતી.

—) સનાતનિયોના દૈત્યસુરો દ્વારા મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં મેં આવ્યા તો તમારી ખેર નથી. નહિતર પરિણામ જોઈ લેવા જેવું થશે. જેની ગંભીરતા થી નોંધ લેજો

1 રમેશ વાઘડિયા
2 હિમતીયા ઝેતાણી
3 પ્રેમલા કેસરાણી
4 રમેશીયા ગોરાણી
5 જયંતી ઈદડાં
6 નારણીયા રામજી

realpatidar.com

https://archive.org/details/bk799/page/n3/mode/1up

2010 Around -Laxminarayan Uttapatti -False Pamphlet (799)

realpatidar.com

પ્રભુમય તેનુ જીવન હતુ. તેના પુત્ર થયા તે દેવો થયા તે સતને માર્ગે ચાલનાર સતપંથી (ભગત) થયા. જયારે બીજી પુત્રી દીતી તામસી ગુણવાળી હતી. તેને કસ્યપ ઋષિ પાસે પુત્ર ની કામના કરી. ઋષિએ તેને વચન આપ્યું. દીતીએ વચન પ્રમાણે પુત્ર માટે ઋષિ પાસે કામની ઈચ્છા કરી. સંધ્યા કાળ હોવાથી ઋષિએ ઈનકાર કરવા છતાં કામતુર બનેલી દીતીએ પોતાનુ એ કાર્ય પુરૂ કરવાથી ઋષિએ તેને શ્રાપ આપ્યો કે , સંધ્યા કાળે આ કાર્યથી જે પુત્ર પ્રાપ્ત થશે. તે યુગોયુગ સુધી આ પૃથ્વી ને ભારરૂપ અસુર દહિત્ય થશે. અને સતપંથીયોને હેરાન કરશે અને એ શ્રાપ પ્રમાણે દીતી ને બે પુત્ર થયા. એક હિરણ્યાંક અને હિરણ્યાંકશીપુ(આધ્યાત્મિક ભાગવત માધવા તીર્થ કૃત પા.નં. ૧૩, મુ.નં. ૪) તે અસુરો ઋષિના શ્રાપ અનુસાર એ કવેળાની પેદાસે તે યુગથી આજ સુધી પોતાનુ તે કાર્ય કર્તા જ રહયા છે.

બીજી બાજુ બીજા સત સનાતની (સતપંથી) સત સાથે સાથે ચાલતા રહયા છે. પાંચ, સાત, નવ, બાર વૈકુંટ ધામ પોંહચ્યા અને આજ દીન સુધી તે તેના સતના માર્ગે ચાલતા રહયા છે. જયારે કહેવાતા અધર્મી અસુરો દૈહિત્યો સતયુગમાં હિરણાંકશુ રૂપે રામ ચંદ્ર ભગવાન વખતે રાવણ બનીને શ્રી કૃષ્ણ ભગવાન વખતે કંસ, દુર્યોધન, દુશાશન બનીને તેનુ કાર્ય કર્તા રહયા છે. અને અંતે તેનો પરાજય થતો રહયો છે.

<u>**અસુરો કલિયુગમાં**</u>

ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગયા પછી ધ્વાપરયુગ પુરો થયો. કલિયુગ ચાલુ થયો. કલિયુગમાં ભગવાન શ્રી નારાયણી રચના પ્રમાણે કલિયુગમાં નિષ્કલંકી નારાયણ નો દસમો અવતાર થવાનો છે. તો તેની સાથે સાથે અસુરો પણ યુગમાં

realpatidar.com

https://archive.org/details/bk799/page/n4/mode/1up

realpatidar.com

... ૩ ....

ધર્મીને ધર્મ છોડાવવા એ અધર્મીયોએ એ દીતીના પુત્રોએ પણ અવતાર લીધ્યો. ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણના ઉપાસક જ્યાં હોય ત્યાં એ અસુરોને પણ તેના નિયમ પ્રમાણે અવતાર લેવો પડે અને તે નિયમ પ્રમાણે અસુરોએ કચ્છ કડવા પાટીદારમાં નારણજી બાપા રૂપે વીરાણી ગામે જન્મ લીધો. (દહીત કાળીંગો)

નારણરામજી લીંમાણી ની ઉત્પતી :- નટ, ભાટ, નાયકડા, ભગત, ભાભાને ભુવા એ છ ના સંગથી કચ્છી, કણબી, મુવા એ પ્રમાણે આપણી સમાજમાં પાટણથી ભવૈયાઓ રમવા આવતા રાત્રે રમતા અને દીવસે સીધુ વગેરે ઉઘરાવતા , દોરા, દાગા, કરતા એજ રીતે કચ્છ વીરાણી ગામે ઉતરયા એ સમયે રામજીબાપો ધંધા અર્થે કરાંચી માં હતા. પણ તેનુ નામ ગામમાં આગળ પડતુ હતુ. ભવૈયાઓનો અડો રામજીબાપાના ઘરે રહેતો. અને એ સમયે એક પ્રભુરામ ભવૈયાએ રામજી બાપાની ઘેર હાજરી પુરી કરી. અને એ અધર્મ કામની જે પેદાસ થઈ તેનુ નામ આ અસત સનાતનના આદ્ધ સ્થાપક અસુરેશ્વર પ.પુ નારાણજી બાપા વર્ણ શંકર કપુત અવર્તયા.

અસુરોનુ કાર્ય :- આ કહેવાતા અસત સનાતન ની કાર્ય છેક સતયુગથી કલિયુગ સુધી ધર્મીને ધર્મથી વિમુખ કરવા, મંદિરો તોડવા, ભગવાન શ્રી નિષ્કલકી નારાયણના દસમા અવતારનો વિરોધ્ધ કરવો, તેનો દુસ પચાર કરવો અને કરાવવો.

અસુરોનો અહાર :- આ કહેવાતા અસત સનાતનીયોનો અહાર સતગોર ના વચન પ્રમાણે જે સતપંથીયો માટે નિષેધ કરેલ છે. તે એમનો અહાર છે. અસુરોનુ ખાણુ, પીણુ જેવુ કે , મંદિરા, ઈડા, માંસ, તમાકુ, અફીણ વગેરે આ લોકોનો ખોરાક છે. સતપંથ મુકયા પછી આ અમલ અહાર અસત સનાતનીયો માટે ખાવો, પીવો એ નવાઈની વાત નથી. અમુક લોકોને લોક લજજા થી ઘરમાં ખાવા ન મળતાં હોય,

realpatidar.com

https://archive.org/details/bk799/page/n5/mode/1up

realpatidar.com

તો બહાર હોટલોમાં વાડીમાં પાર્ટી ઓ કરી મહેફીલ કરી ખાય છે. અને ખવડાવે છે. સાંજે ઘરે આવે ત્યારે ભાન પણ રહેતુ નથી. આ લોકોના સંતાનો બાપ આગળ આવો ખોરાક ખાય પીવે એ કઈ નવાઈની વાત નથી. તમારા મોઢા તો જોવો કેવા ગટર જેવા છે.

લક્ષ્મી નારાયણ ભગવાન :- લક્ષ્મી નારાયણ ભગવાનના મંદિરો ઘણી જગ્યાએ છે. પણ આ કચ્છી, કડવા પાટીદારમાં કયાંથી લક્ષ્મી નારાયણ પેઠાં તો સાંભળો નારાણબાપો રામજીબાપાની રાહે કરાંચી ધંધા અર્થે ગયા હતા. અને અમુક વર્ષ પછી જ્યારે માદરે વતન વીરાણીમાં પાછા આવ્યા ત્યારે ગામમાં અવાર-નવાર ભવૈયા આવતા હતા. એ ભવૈયાની સાથે તેમનો પરિવાર પણ આવતો હતો. તેમની એક ભવૈયણ(તરગારણ) ધન લક્ષ્મીબાઈ કરીને પણ હતી. નારણબાપો પણ આ ભવૈયાઓ સાથે અમુક પાત્ર લેતાં અને સાથે રહેતાં. પ.પુ. નારાણબાપો દેખાવડા, યુવાન, કુંવારા હતા.. લાંબા સમય સાથે રહેવાથી નારણબાપા અને લક્ષ્મીબાઈ નુ મન મળી ગયુ. આ બંનેની આ વાતની ગામના સમાજને તથા ગેઢેરાઓને ખબર પડી એ વખતે કચ્છ કડવા પાટીદાર બધાં જ સતપંથી હતા. ગેઢેરાઓને આ કૃત્ય પસંદ ન હતુ. તેથી વડીલોએ નારણબાપાને હડધુત કર્યા. ત્યાર બાદ નારણબાપો ધન લક્ષ્મીબાઈને લઈ ને પીરાણા લક્ષ્મણકાકા પાસે ગયા. કાકાએ પણ તેમને સખત શબ્દોમાં ઠપકો આપી હડધુત કર્યા. આથી નારણબાપાને ચોટ લાગી અને વડીલો અને સતપંથને કાંઈક કરી બતાવવા ની ટેક લીધી. નારણબાપાની ઉત્પતી તો આસુરી હતી. અને પોતે વર્ણ શંકર હતા અને ફરીથી લક્ષ્મીબાઈ વાળુ આ કુકર્મ ડબલ અધર્મ થયો. (વિનાશકાળે વિપરીત બુધ્ધી) તે પ્રમાણે અધર્મએ જોર પકડયું નારણબાપો વીરાણી કચ્છ થી લક્ષ્મીબાઈ તથા દસ-વીસ તેમના સથીદારો સાથે મુંબઈ તરફ નીકળી ગયા . તેમના સાથી રતનસી

realpatidar.com

https://archive.org/details/bk799/page/n6/mode/1up

realpatidar.com

ખીમજી ખેતાણી વગેરે સાથ સહકાર થી લક્ષ્મીબાઈને આપેલ વચન પ્રમાણે લક્ષ્મીબાઈ અને નારણબાપે નક્કી કરેલ કે આપણુ બંનેનુ નામ અમર થાય અને આપણાં આ વડીલોને પણ સજા થાય એવુ કંઈ કરીએ. એ પ્રમાણે નક્કી કરી લક્ષ્મીબાઈનુ નામ આગળ રાખી પાછળ પોતાનુ નામ રાખી લક્ષ્મી નારાયણ નામનો પંથ શરૂ કર્યો. તેના સહકાર માટે અસુર ગુરૂ ઓધવરામ ની મદદ લીધી. નારણબાપા પાસે આર્થિક જોર હતુ. તે જોરે એક એક કરીને સતપંથીઓને સતપંથ છોડાવવાનુ કાર્ય કયુ. સીધી રીતે ન માને તેની ઉપર અત્યાચાર કરી ધર્મ વિમુખ કર્યા ભગવાન શ્રી નારાયણ ની રચના પ્રમાણે દરેક યુગમાં ત્રૈતીસ કરોડ દેવો ને છાસઠ કરોડ અસુરો એ પ્રમાણે અધર્મીઓ સતપંથીઓ કર્તા ડબલ થયા. છતાં પણ સદ-ગુરૂ મહારાજની કૃપાથી અંતે તો સત્યનો વિજય થતો રહયો છે. એ જ પ્રમાણે અસુરો , દૈહિત્યો અવતાર લેતાં લેતાં ચાલ્યા આવે છે. જેવા કે, ગુજરાતના તખતગઢમાં શામજી મતાદાર થયા એવાં જ અને કચ્છમાં પણ વખતો વખત આવા અસુરો થતાં રહયાં છે. અને સતપંથીને માનસિક અને આર્થિક ત્રાસ આપતાં રહયાં છે.

બીજી બાજુ સતપંથ સનાતન ધર્મમાં પણ સંતો, સાધુઓ છેક સતયુગથી આજ સુધી એક પછી એક થતાં રહયા છે તેનો અસત સામે વિજય થતો રહયો છે. જેવાં કે કચ્છમાં ખેતાબાપા, ગોપાલબાપા, કુંવરમા, નથ્થુરામબાપા, રામજીબાપા. જેને વર્ષો બાદ આજે પણ ધુપ અને ધજાઓ ચડે છે. અને તેના દર્શને તમો ઠોલીયાઓ, લક્ષ્મીનારાણીયાઓ, વીધર્મીઓ આવો છો. અને તમારી પત્નીઓ તથા સંતાનો બાધા માનતાંઓ રાખી પગે લાગો છો. અને તમારા પણ કાર્ય થાય છે. તમારા માં પુછો તો ખરા કે, આવા કોઈ સાધુ સંતો છે ખરાં ?

realpatidar.com

realpatidar.com

જગતગુરૂ કરશનદાસજી મહારાજ :- ઉપર ના વર્ણન પ્રમાણે સતપંથીઓ ઉપર ઠોલીયાનો ત્રાસ વધતાં તમારા મોટા સમુહને એક ચપટ્ટી ભર કરી દેનારા અને સબક શીખાડવા માટે તમારા બાપ કરશનદાસજીને પીરાણાંની ગાદી પર સદગુરૂ મહારાજે મુકયા. અને તમારી માખ તેલમાં પડી ગામે ગામે સતપંથ મંદિર બનાવ્યા, નવી પીઠો ઉભી કરા. આશ્રમો બનાવ્યા, મોટામોટા સંમેલનો કર્યા, સાધુ-સંતોના મેળાવડા કર્યા, જગત ગુરૂનુ બિરુધ્ધ મેળવ્યુ અને ચારે તરફ સતપંથનાં જય જય કાર થર્યો. તમને પણ તમારા ધર્મ ઉપર નફરત થવા લાગી. તમારા છોકરાં, તમારી પત્નીઓ બધાં જ અંદરો-અંદર સતપંથી બની ગયા અને પુજાઓ ભરાવવા લાગ્યા. નારણબલી કરાવવા લાગ્યા. જાણે કે આખો કચ્છ કડવાપાટીદાર સમાજ જ નહિ પણ આખુ વિશ્વ સતપંથી થઈ જશે એવુ વાતાવરણ બની ગયુ. મંચ ઉપર તમારા પદ ઉપર જાણે કે તમે એકલાં ગણયા ગાંઠયા અસુરો એકલા જ રહયા હોય અને નીચેથી બધાં જ સતપંથી થઈ ગયાં હોય તેમ લાગતાં અસુર શકિત ફરીથી મોડાસામાંથી જાગૃત થઈ અને એક પછી એક અસુર વસંજો ભેગા થવા લાગ્યા.

અસુરોની ગતી :- આ લક્ષ્મી નારાણીયા જેવાં આવા અસુરોને છેક સતયુગથી આજ સુધી અંતે તો તેનો પરાજય થાય છે. જેવાં કે હરિણાંકશ, રાવણ, દુર્યોધન , નારાણબાપા, શામજી મતાદાર , ધન લક્ષ્મીબેન ની કેવી અધોગતી થઈ તે સાંભળો નારણબાપાને અંત સમયે નિષ્કંલકી નારાયણના ઝપાટામાં આવતાં ભગંદર જેવાં અસહય રોગમાં પીડાતાં માફી માગતાં મે કર્યુ. તેવુ અધર્મ કાર્ય કોઈ ન કરશો. તેવુ કહેતાં ગયાં. ધન લક્ષ્મીબાઈ પણ એજ રીતે ગયાં. શામજી મતાદારા ની તો જુવોગતી કેવી થઈ જે સતપંથીઓને મુસ્લમાન કહેતાં હતાં. તે શામજી મતાદારને અંત સમયે તેના પરિવાર ન રાખતાં . એક મુસ્લમાન ચોકીદાર ને ત્યાં પોતાની પાછળની જીંદગી રિબાતાં રિબાતાં પુરી કરી. મે કર્યુ તેવુ ધર્મ વિરૂધ્ધનુ કાર્ય હવે

realpatidar.com

realpatidar.com

પછી કોઈ ના કરશો. આજના આપણા આ સનાતની કહેવાતાં મંચ ઉપર ભાસણો આપતાં મહાનુભવો જેવાં કે, રમેશ વાઘડીયા, હિંમત ખેતાણી, રમેશ ગૌરાણી, જયંતી ઈઘણુ, પ્રેમજી કેશરાણી, વગેરેની ગતી તો તેના કર્મ પ્રમાણે શામજી મતાદાર જેવી થવાની છે.

લક્ષ્મી નારાયણ ધર્મીઓની રહેણી કહેણી અને આહાર વ્યવહાર :- તમે પોતાને સનાતની કહો પણ ઉપર મુજબના કામ કરનાર ને અમે દુનિયા કદાપી સનાતની નહિ કહીએ અમે તમને ઢોલીયા વિધર્મી કહીશુ. અને તમે પણ તમારા નમ ની આગળ દેવ જેવા નમનો શબ્દ પ્રયોગ ન કરતાં દૈહિત્યો, અસુરો જેવાં શબ્દનો ઉચ્ચાર કરવો જોઈએ. જુવો તો ખારાં સનાતની જેવાં તમારા ડાચા છે ખરાં ? ગટર જેવાં તમારાં મોઢા છે ? મુસ્લમાન જેવાં તમારા આહાર છે ? તમારા તથા તમારા યુવાનોના ખોરાક જેવાં કે ખીમો, બીરીયાની, કબાબ, તમાકુ, દારૂ, તમને શોભે છે. તમને અને તમારા નોકર, ચાકર ને એક ખોરાક અને એક ગોળાનુ પાણી ચાલે છે. ધર્મને બદલવાના પાખંડ કર્તા રમેશ વાઘડીયાની બહેન મુંબઈમાં મુમનાને ઘરે ગઈ હોત તો-તો ઠીક પણ આતો કટ્ટર મુસ્લીમના ઘરમાં ત્રણ છોકરાં લઈને બેઠી છે. તે કેટલી શરમ જનક ઘટના છે. ?

સતપંથીઓનુ આચરણ :- તમને પણ સતપંથીઓને જોઈને તમારા ઉપર નફરત જતી હશે. અમારા સદગુરૂ એ હીંસા ની તો વાત જ કયાં પણ પ્રભાતે કાચા કોમળ ફુલ તોડવાની ના કહી છે. તમારા પાંચ જણ વચ્ચે એક સતપંથી ઉભો હોય તેનુ દેવ જેવુ સ્વરૂપ આગવુ દેખાઈ આવે છે. તમારા ઘરમાં રજસવાલા ધર્મ જેવુ કંઈ પણ હોતુ નથી. સતપંથી ઓની સ્ત્રી ઓ આ ધર્મ પાળે છે. તમને અડકવુ , તમારી સાથે વ્યવહાર રાખવો એ સતપંથીઓ માટે એક કલંક રૂપ છે.

realpatidar.com

realpatidar.com

ધ્યાન રાખજો. :- તમે ઢોલીયાઓએ શ્વેત પત્રો બહાર પાડી બહાલી આપો છો પણ અમારા સતપંથીઓની સંપતી, ઉમદા ધાર્મિક લાગણી અને ઉચ્ચ શિક્ષણ અને સમજણ ધરાવતાં અમારા તેજસ્વી છોકરાંઓને જોઈને તમારી છોકરી ઓ અમારા છોકરા સાથે આવી તો જશે. જરાં ધ્યાન રાખાજો - સાચવ જો અમો તેમને ગંગાજળ પાઈને પવિત્ર કરીને તેનો સ્વીકાર કરીશુ. બીજી વાત સંપતી, સંતતી , ભણતર, નડતર વગેરે માટે પીરાણાની બાધાઓ તો તમારી બાઈ માણસો તમારી ના હોવા છતાં પણ એ "ક્યાંદુ ઓ મંદોદરિયો" જરૂર રાખશે. અને અમે તેમને માન આપી આવકારીશુ. પીરાણામાં તમારા સ્વજનોની સદગતી માટે પુનમ અને અમાસ ના નારણબલી કરાવવા આવો છો. અને હજુ પણ આવતાં રહેશો.

ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણ સદગુરૂશ્રી ઈમામ શાહ મહારાજ સાથે વેર-જેર છોડી તેના બની તેની શરાણાંગતી સ્વીકારવામાં જ તમારુ કલ્યાણ છે. નહિ તો તમને ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણ નહિ છોડે.

છેલ્લે જેવી આશા તેવા વાસા ના નિયમ પ્રમાણે પરમ કૃપાળુ પરમાત્મા જીંદગી ભર તમે જેમનુ રટન કર્યુ છે. તેવા મુમના, મુસ્લમાન, ઈસ્લામ, કલમા વગેરેનુ રટન કરતાં કરતાં તમારો જીવ જાય ભગવાન તમારો જન્મ ઈસ્લામી દેશમાં કટર પંથી મુસ્લીમના ઘરે તમારો નવો જન્મ આપે એ જ આશા સાથે તમારો સુભેચ્છક તમારો બાપ એજ સતપંથી

દૈહિત્ય ગુરૂ શુક્રાચાર્ય નમ :

દૈહિત્ય ગુરૂ ઓધવરામય નમ :

દૈહિત્ય ગુરૂ કૃષ્ણા નંદજી નમ :

દૈહિત્ય ગુરૂ વાલરામાય નમ :

દૈહિત્ય ગુરૂ હરિદાસાએ નમ :

realpatidar.com

realpatidar.com

એવા જ આદ અસુરેશ્વર શ્રી નારાણબાપા તથા રતનશી ખીમજી તેમજ વર્તમાન સમયના રમેશ વાઘડીયા, હિંમત ખેતાણી, પ્રેમજી કેશરાણી, રમેશ ગૌરાણી, જયંતિ ઈધણુ એ બધા ને અમારા બધાં જ સતપંથીઓના ભલાદુર બાવા.......................

સમજે પાટીદાર મર્મમાં,

આવી જાય નાનકદાસના શરણમાં,

ભળી જાય સતપંથ સનાતન ધર્મમાં,

ખાસ નોંધ :- સતપંથમાં આવવુ હોય તો તમને તમારા આ અસુરી આહાર વ્યવહારો જેવાં કે દારૂ, આમલેટ, માંસ, તમાકુ કાયમી છોડયાં પછી ગંગાજળ પાઈ મંત્રો ઉચ્ચારથી પવિત્ર કરી તમારો સ્વીકારા કરવામાં આવશે.

......................સતપંથ સનાતનની જય..........................

..........................શ્રી નિષ્કલંકી નારાયણની જય.........................

...............પ.પુ. જગતગુરૂ કરશનદાસજી મહારાજની જય...................

.................પ.પુ. જગતગુરૂ નાનકદાસજી મહારાજની જય.......................

આ પત્રિકા વાંચનાર, સાંભળનાર દરેક ધર્મપ્રેમીઓએ દસ-દસ પત્રિકા છપાવી પોતાના મિત્ર મંડળ, સગા-સબંધીમાં વહેંચવી.

realpatidar.com